



27.01.2020

To,
The Bombay Stock Exchange Limited
Department of Corporate Service
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai - 400001

Dear Sir,

<u>Sub.:- Notice of meeting of Board of directors</u> Scrip Code: 519014

This is to inform you that a meeting of Board of Directors of the company will be held on Tuesday, 04th February, 2020 at 02:00 p.m. at the registered office of the company to consider and approve the quarterly unaudited Standalone financial results of the company for the quarter ended 31st December, 2019.

Kindly take the same on record.

Thanking You

Yours faithfully,

For Prashant india Limited

Prabhudas Mohanbhai Gondalia Managing Director

DIN: 00014809





Date: 28.01.2020

To,
The Bombay Stock Exchange Limited
Department of Corporate Service,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street Fort,
Mumbai- 400001

Sub: Notice of Board Meeting -Newspaper Publication

Scrip Code: 519014

Dear Sir,

Please find enclosed a copy of the newspaper clippings of the advertisement published on 28^{th} January, 2020 on the subject matter, in the following newspaper:

- Financial Express - English

- Financial Express - Gujarati

The same has also been made available on the Company's website.

Kindly take the same on record.

Thanking You,

Yours faithfully, For Prashant india Limited

Prabhudas Mohanbhai Gondalia Managing Director

DIN: 00014809

Regd. Office: Block 456, Palsana Char Rasta, N. H. 8, PALSANA - 394 315. (Dist. Surat Gujarat.)
Ph.: 9375055557, E-mail :cs.prashantindia@gmail.com, Website : www.prashantindia.info

HESTER

HESTER BIOSCIENCES LIMITED

Registered Office: 1st Floor, PUSHPAK, Panchvati Circle, Motilal Hirabha Road, Ahmedabad 380 006. **Phone:** + 91 79 26445106 Fax: +91 79 26445105 Email: mail@hester.in

Website: www.hester.in CIN: L99999GJ1987PLC022333 NOTICE

Pursuant to Regulation 47 read with Regulation 29 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on Friday, 7 February 2020 at 10.30 a.m. at its Registered Office at 1st Floor, Pushpak, Panchvati Circle, Motilal Hirabhai Road, Ahmedabad 380 006, to consider the Standalone and Consolidated Unaudited Financial Results for the quarter and nine months ended on 31 December 2019.

You may also refer the website of the Company at www.hester.in and the stock exchange(s) at www.bseindia.com and www.nseindia.com for further details. For Hester Biosciences Limited For Hester Biosciences Limited

Date: 27 January 2020 Place: Ahmedabad

Rajiv Gandhi CEO & Managing Director



Guiarat State Financial Corporation

Gujarat State Financial Corporation

Secretarial Cell

Block No.10, Udyog Bhavan, Sector-11, GH-4, Gandhinagar – 382 010
Phone: (079) 23256766 Fax: (079) 23252204

Website: www.gsfc.gujarat.gov.in E-mail: sec-cell-gsfc@gujarat.gov.in

NOTICE

Notice is hereby given, pursuant to Regulations 29 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Corporation will be held on Monday, the 10° February, 2020 at 1.00 pm in the Committee Room of Industries & Mines Department, Block No. 5, 3° Floor, Sachivalaya, Gandhinagar to approve, inter alia, the unaudited financial results of the Corporation for the nine months/quarter ended 31° December, 2019. The intimation to BSE Ltd is available on the websites of the Corporation (www.gsfc.gujarat.gov.in) Ltd is available on the websites of the graph of the state of the graph of the graph of the state of the graph of the grap Date : 27/01/2020

PRASHANT INDIA LIMITED

Regd. Office: Block No.456, N.H.No.8, Palsana-394315, Dist.Surat (Gujarat

NOTICE pursuant to regulation 29 & 47 of SEBI(Listing Obligations and

Disclosure Requirements) Regulations, 2015 is hereby given that a

Meeting of the Board of directors of Prashant India Ltd. will be held at

Registered Office of the Company on Tuesday, 04^{TH} February,2020 at

02:00 P.M. to consider and approve the Unaudited Financial Results fo

the quarter $\,$ ended 31.12.2019. This information is also available on the

Company's Website at www.prashantindia.info and also on the Website

For Prashant India Ltd

Sd/- Managing Director

• NOTICE

सेन्ट्रल जेंड ओइ ईन्डिया सेन्ट्रल बैंक ओफ इंडिया ☐ CENTRAL BANK OF INDIA

Regional Office:- Lal Darwaja, Ahmedabad - 380001 POSSESSION NOTICE

PPENDIX – IV [Rule – 8(1)] (For imm

Whereas The undersigned being the authorized officer of the Central Bank of India, Sanand Branch, Dist. Ahmedabad under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14.11.2019 calling upon the Borrower M/s. Gujarat Insecticide and Fertilizers (Partnership Firm), Mr. Dhaval Ramanial Gohil (Partner), Mrs. Alka Dhaval Gohil (Partner) to repay the amount mentioned in the notice being Rs. 24,85,700/- (In Words Rs. Twenty Four Lakh Eighty Five Thousand Seven Hundred Only) with interest as mer notice, within 60 days from the date of receipt of the said Notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred or him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 23rd day of January of the year 2020.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount Rs. 24,85,700/- (In Words Rs. Twenty Four Lakh Eighty Five Thousand Seven Hundred Only) and interest thereon w.e.f. 14.11.2019 plus other charges. (Amount deposited after issuing of Demand Notice under Section 13(2) has been given effect)

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act. in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

Equitable Mortgage of Property in the Name of M/s. Gujarat Insecticide & Fertilizer Partnership Firm Through Its Partner Mr. Dhaval Ramanlal Gohil & Mrs. Alka Dhaval Gohil, Bearing Shed No. 19/A Paiki, Natraj Industrial Estate, Opp. Bhagyoday Hotel Viramgam Road, Village - Ivava, Tal - Sanand, Dist, Ahmedabad, Sub Plot No.19 Paiki of Revenue Survey No. 193 Paiki, Admeasuring About 1950 Sq. Meter Paiki 836 Sq. Meter, Mouje - Vasna Eyava, Tal. Sanand, Dist. Ahmedabad, **Bounded By :- East**: Sub Plot No. 20, **West**: Land of Sub Plot No. 19 Paiki, **North**: Road, **South**: Sub Plot No. 18.

Nate: 23.01,2020. Place: Sanand Authorised Officer, Central Bank of India

Corporation Bank (Govt. of india undertaking)

TILAK ROAD BRANCH, JEEVAN PRAKASH BUILDING, AHMEDABAD-380001 Tel: 079-25511198, 25511194, 25511193 Email: cb673@corpbank.co.in

APPENDIX-IV [Rule-8(1)] POSSESSION NOTICE (For immovable property) Whereas the undersigned being the Authorized Officer of **Corporation Bank Tilak Road Branci** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 or Net, 2002 (34 or 2002) and in reservices on powers connented under section (31/2) read with rule 3 or the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 22/10/2019 under section 13(2) of the said act calling upon the borrower & mortgagor 1. M/s Sarjan Construction Proprietor Mr Ashokhhai Ladabhai Patoliya, A/54 ,Shreedhar Bunglows, Near Ayush Tenament Opposite Aditya Complex, Nikol Gam Road, Nikol , Ahmedabad to repay the amount mentioned in the notice being Rs. 71,97,208.68/- (Rs. Seventy One Lakhs Ninety Seven Thousand Two Hundred and Eight and Paise Sixty Eight Only) together with further interest there on at the contractual rate

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the

Security Interest Enforcement Act Rule 2002 on this the **24th Day of January 2020**.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to charge of Corporation Bank Tilak Road Branch for an amount of Rs. 71,97,208.68/- (Rs. Seventy One Lakhs ninety Seven thousand Two Hundret Eight and Paise Sixty Eight Only) together with further interest there on at the contractual rate plus cost, charges and expenses till date of payment

The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the act in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

- All that piece & parcel of the immovable property residential Plot No A/54 (Final Plot No 62+63) adm about 192.63 sq mtrs along with undivided share in the ownership land of Shridhar (Nikol) Co Op Housing Society Ltd with construction adm 225 sq yds thereon the scheme known as Shridhar Bunglows on land bearing survey no 272/3 of FP No 62 admeasuring 6921 sq mtrs and Survey No 272/4 of Final Plot no 63 adm 4128 Sq Mtrs aggregating 11049 sq mtrs of TP Scheme No 103 of mouje Nikol, taluka city in the Registration District Ahmedabad and Sub District Ahmedabad 12 (nikol). Boundaries : Eas Main Road, West: Plot No A/49, North: Plot No A/55, South: Plot No A/53
- All that piece & parcel of the immovable property Shop No 4 on GF floor adm. 37.63 sq mtr super built up area with undivided share in land adm 12.60 sq mtrs of building/scheme as Shivam Residency of M/s Shivam Properties, a partnership firm lying and situated on land bearing Survey No 479/1 of TPS No 119 of FP No 121/1 adm. 2671.00 sq mtrs at of mouje Nikol of asarva Taluka in the registration District of Ahmedabad and sub District Ahmedavad-12 (Nikol) Boundaries: East: 80 fts road, West: Parking, North: Shop No 5 South: Shop No 3

Corporation bank

FORM A

PUBLIC ANNOUNCEMENT (Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

FOR THE ATTENTION OF THE CREDITORS OF RIDDHI SIDDHI COTTON GINNING AND PESSING PRIVATE LIMITED RELEVANT PARTICULARS RIDDHI SIDDHI COTTON GINNING AND Name of Corporate Debtor PESSING PRIVATE LIMITED Date of incorporation of Corporate Debtor 22/03/2006

Registrar of Companies, Ahmedabac Authority under which Corporate Debtor Corporate Identity No. / Limited Liability U17110GJ2006PTC047981 Identification No. of corporate debtor Survey No 251/P-2, Rajkot Jamnagar Highway, At Mota Address of the registered office and principal office (if any) of corporate debtor Rampar, Taluka Paddhari, Rajkot-360110, Gujarat Insolvency commencement date in 13/01/2020 (Order Received on 25/01/2020) respect of corporate debtor

Estimated date of closure of insolvency 11/07/2020 Name and Registration number of the Name : Atul Mittal insolvency professional acting as interim Reg. No.: IBBI/IPA-001/IP-P00439/2017-18/10762

Address: 174, BALCO Apartments, Plot No.58, IP Address & email of the interim resolution Extn., Patparganj, Delhi-110092 Email: a.mittalmc@gmail.com professional, as registered with the board Address: 163, BALCO Apartments, Plot No.58, IP

Address and e-mail to be used for Extn., Patparganj, Delhi-110092 resolution professional Email: rajkot.ipamittal@gmail.com Last date for submission of claims 08/02/2020

Classes of creditors, if any, under clause (b) NA of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional Names of insolvency professionals identified NA to act as authorised representative of creditors in a class (three names for each class)

resolution professional

(a) Relevant forms and Weblink: https://ibbi.gov.in/home/downloads (b) Details of authorized representatives Physical Address: NA are available at: Notice is hereby given that the National Company Law Tribunal has ordered the commencement of a corporate insolvency resolution process of the Riddhi Siddhi Cotton Ginning and Pessing Private

Limited on January 13, 2020. The creditors of Riddhi Siddhi Cotton Ginning and Pessing Private Limited, are hereby called upon to submit their claims with proof on or before February 08, 2020 to the interim resolution professional at the

address mentioned against entry No. 10. The financial creditors shall submit their claims with proof by electronic means only. All other creditors

may submit the claims with proof in person, by post or by electronic means. Submission of false or misleading proofs of claim shall attract penalties

Atul Mittal Date: 27/01/2020 Interim Resolution Professiona Reg. No.: IBBI/IPA-001/IP-P00439/2017-18/10762

Muthoot Finance MUTHOOT HOMEFIN (INDIA) LTD

CIN - U65922KL2011PLC029231 Comporate Office: 1201 & 1202, 12th Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai – 400 063.

Regional Off.: Muthoot Homefin (India) Limited 1st Floor, Sanstar House Opp. Suvidha Shopping Centre Near Parimal Underbridge, Paldi

APPENDIX-IV-A [See proviso to rule 8(6)]

PUBLIC NOTICE FOR AUCTION CUM SALE

Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower/s, offers are invited by the undersigned in sealed covers for purchase of immovable property, as described hereunder, which is in the physical possession, on 'As Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever Is There Is Basis', Particulars of which are given below:

Sr No	Borrower(s)/Co-Borrower(s)/ Guarantor(s) / Loan Account No.	Demand Notice Date and Amount	Description of the Immovable property	Reserve Price (RP)	Earnest Money Deposit (EMD) (10% of RP)
1	Kirankumar R Patel/ Kavitaben Kiranumar Patel/ 007-00000206 / Ahmedabad	(Rupees Thirty One Lac Twenty Three Thousand Five	Immovable Properties: All that piece & parcel of Plot No.89,Adm.163.85 Sq.Mtrs., Labdhi Green Residency, Valsana Road, Survey No.90/1 Paiki 1,Mouje-Sadatpura,Dist-Sabarkanta, Gujarat-383001.More Particularly Mentioned in the Sale Deed No 3951/2015 Dated 08.12.2015 registered at Sub-Registrar Office Idar. Having Boundaries North: 7.5 Meter Road, South: Plot No. 88, East: Plot No. 42, West: 7.5 Meter Road	(Rupees Forty One Lac Eighty Nine	Rs. 4,18,917/- (Rupees Four Lac Eighteen Thousand Nine Hundred Seventeen Only)

- 1. The Auction is being held on "AS IS WHERE IS" AND "AS IS WHAT IS" basis
- 2. The detailed terms and conditions of the auction sale are incorporated in the prescribed tender form, available at the above mentioned regional office 3. Last Date of Submission of Sealed Bid/Offer in the prescribed tender forms along with EMD payable by way of Demand Draft in Favor of 'Muthoot Homefin (India) Ltd' along with KYC is on 06-03-2020 till 4:00 PM at the Regional Office address mentioned herein above. Tenders that are not filled up completely or tenders received
- beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD. 4. Date of Inspection of the Immovable Property is on 04-03-2020 between 1.00 P.M to 3.00 PM.
- 5. Date of Opening of the Bid/Offer Auction Date for Property is 07-03-2020 at the above mentioned Regional Office address at 1:00 PM. by the Authorised Officer. 6. The MHIL shall not be responsible for payment of any outstanding statutory notice & Encumbrances / taxes arrears etc. if any & their Responsible to pay the sum would be that of the Successful auction purchase. The Intending bidder should make their own independent inquiries regarding the Encumbrances Title of property & also inspect & satisfy themselves.
- 7. The Highest bidder shall be subject to approval of MHIL Ltd. Authorised Officer shall Reserve the right to accept all any of the offer /Bid so received without assign any reason whatsoever. His decision shall be final and binding
- 8. The Borrower(s)/Guarantor(s) are hereby given 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002 to pay the sum mentioned as above before the date of Auction failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to Muthoo Homefin (India) Ltd. in full, before the date of sale, auction is liable to be set aside

For further details, contact the Authorised Officer, at the above mentioned Office address Contact Person - Khumansinhy Zula - 9166346933

Authorized Officer. Place: Ahmedabad Date: 28/01/2020 Muthoot Homefin (India) Limited



of the Stock Exchange at www.bseindia.com

Place: Palsana

Date: 27.01.2020

<u> Muthoot Homefin (India) Ltd</u>

Corporate Office: 1201 & 1202, 12th Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai – 400 063.

POSSESSION NOTICE

(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. (MHIL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken Symbolic/Physical Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Muthoot Homefin (India) Ltd. for an amount as mentioned herein under

Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s)/ Loan Account No./Branch	Description of secured assets (immovable property)	Date of Demand Notice & Total Outstanding Dues (Rs.)	Date of Possession
1	Hareshbhai Kanjibhai Bhalani/ Bhavnaben Hareshbhai Bhalani / 004-00401648/Surat	Plot No.31,Adm.50.17 Sq. Mtrs. Along with 32.93 Sq.Mtrs. undivided share in the road, in "Dharma Row House",Surve No.96,97,94,92, Block No.54/A/1, ,Village-Syadala,Taluka-Olpad,Dist-Surat,Gujarat-394130.More particularly as mentioned in the sale deed having Reg. No. 13803/2017 on dated 08/09/2017 in the office of Joint Sub Registrar Olpad.	31-08-2018/ Rs. 12,84,920/- (Rupees Twelve Lac Eighty Four Thousand Nine Hundred Twenty Only)	25-01-2020
2	Ghanshyam Ramashre Choudhary/ Ninitadevi Ghanshyam Choudhary/ 004-00401427/Surat	Flt No. 405, 4Th Floor, Adm.24.43 Sq.Mtrs., Om Sai Complex, Soni Park Society-2, Plot No.271,272 & 273,Block No.2,Tatithaiya Gam Road, Village-Tatithaiya, Palsana, Dist- Surat, Gujarat-394305.More Particularly mentioned in Sale Deed No.11391/2017 Dated 09/08/2017 in the office of joint Sub Registrar Palsana.	28-09-2018/ Rs. 6,52,582/- (Rupees Six Lac Fifty Two Thousand Five Hundred Eighty Two Only)	25-01-2020
3	Ranjitkumar Shankar Ray/ Mangalidevi Shankarray Ray/ 004-00402087/Surat	Immovable Properties: All that piece & parcel of Plot No. 113, admeasuring 40.18 sq. mtr along with 24.65 mtr. area, in the Building known as "Garden Valley", situated at Resurvey No. 71, Block No. 93, Near Garden City, Jolwa, Village Jolwa, Tal. Palsana, Surat — 394305, Gujarat. More particularly mentioned in the Sale Deed Registration No. 15363, Dated 10/10/2017 in the office of Joint Sub Registrar Palsana. Having Boundaries North: Plot No. 112, South: Plot No. 114, East: Plot No. 146, West: Society Road	21-01-2019/ Rs. 11,73,502/- (Rupees Eleven Lac Seventy Three Thousand Five Hundred Two Only)	25-01-2020
4	Rohit Rameshchandra Bhimani/ Jalpaben Rohitbhai Bhimani/ 004-00402692/Surat	Immovable Properties: All that piece & parcel of Plot No - 35,R S.No.124/A Paiki C, Maruti Nandan Homes & Business Hub, Behind Welspun Crop Ltd, Vav Village, Vagra, Dahej - Bharuch Main Road, Bharuch - 392140. More Particularly Mentioned in the Sale Deed No. 154/2018 Dated 05.02.2018 registered at Sub-Registrar Office Wagra. Having Boundaries North: Open Plot, South: Internal Road, East: Open Plot, West: Internal Road.	08-07-2019/ Rs. 27,23,532/- (Rupees Twenty Seven Lac Twenty Three Thousand Five Hundred Thirty Two Only)	25-01-2020
5	Bhanwarsingh Shankar Singh/ Mora Kanwar Bhanwar Singh/ 043-04300017/Bharuch	Immovable Properties B 34 Pavanpuri-2,0ff Dahej Bypass Nanelaav Road, Near Auxillum School Hotel Raj Green, Bharuch, Bharuch, Gujarat,392002. More particularly in the Sale Deed Registered No. 239 Dated 10-01-2018 in the office of Sub Registrar Bharuch. Having Boundaries North : Open Plot, South : Plot No 37, East : Open Plot, West : Plot No A-34	30-08-2019/ Rs. 30,53,318/- (Rupees Thirty Lac Fifty Three Thousand Three Hundred Eighteen Only)	25-01-2020
6	Makulbhai Sundarbhai Mandal/ Chathan, Surat, Surat, Gujarat, 395304. More particularly in the Sale Deed Registered No. 11293 Dated 03-08-2017 in the office of Sub Registrar Palsana. Having Boundaries:- North: Plot No 47-48, South: Road, East: Society Road, West: Plot No 91		10-09-2019/ Rs. 9,47,402/- (Rupees Nine Lac Forty Seven Thousand Four Hundred Two Only)	25-01-2020
7	Nareshbhai Kalubhai Dholiya/ Gitaben Nareshbhai Dholiya/ 043-04300123/Bharuch	Immovable Properties Plot NO $-$ 40 , Marutinandan Homes, Business Hub , B/H Welspun Crop. Ltd, Dahej-Bharuch Main Road,Bharuch,Bharuch,Gujarat,392140. More particularly in the Sale Deed Registered No. 1122 Dated 01-08-2018 in the office of Sub Registrar Wagra. Having Boundaries:-North: Plot No 39, South: Plot No 41, East: Plot No 49, West: Society Road	10-09-2019/ Rs. 24,55,673/- (Rupees Twenty Four Lac Fifty Five Thousand Six Hundred Seventy Three Only)	25-01-2020
8	Upeshbhai Mahendrabhai Patel/ Bhavika Upeshbhai Patel/ 043-04300142/Bharuch	Immovable Properties Flat No 202 2nd Floor Tower No 40 Dahej, Royal Township Bharuch Dahej Main Road, Tal Vagra Dist Bharuch, Bharuch, Bharuch, Gujarat, 392015. More particularly in the Sale Deed Registered No. 917 Dated 18-06-2018 in the office of Sub Registrar Wagra. Having Boundaries:- North: Society Interval Road, South: Building Passage, East: Tower No 41, West: Building	10-09-2019/ Rs. 15,40,236/- (Rupees Fifteen Lac Forty Thousand Two Hundred Thirty Six Only)	25-01-2020

Authorised Officer Place: Gujarat Date: 25.01.2020 For Muthoot Homefin (India) Ltd.



I choose substance over sensation.

Inform your opinion with credible journalism.

The Indian Express. For the Indian Intelligent.





indianexpress.com

For Prashant India Ltd. Place: Palsana Date: 27.01.2020 Sd/- Managing Director

કંપનીના મામલા અધિનિચમ, ૨૦૧૩માં અને મેસર્સ શાહી મનીચેન્જર પ્રાન્લિન્ના મેટરમાં કંપનીના રજિસ્ટ્રાર, ગુજરાત

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨૫૨ હેઠળ કંપનીના નામની પુનઃસ્થાપના અંગે કંપની અપીલ નંબર ૫૨/૨૫૨ (૩)/ એનસીએલટી/૨૦૧૯ ના મામલે

ઉપરોક્ત નામવાળી કંપની એટલે કે મેસર્સ **શાહી મનીચેન્જર પ્રાન્લિ**. નુ પુનઃ સ્થાપના માટે નિર્દેશિત કંપની અપીલ નં. ૫૨/૨૫૨(૩)/એ.એચ.એમ/૨૦૧૯ માં ગુજરાત સરકારના માનનીય એન.સી.એલ.ટી ના હુકમનામાં દ્વારા તા.૧૮.૦૯.૨૦૧૯ નાં રોજ જાહેર કરવામાં આવ્યું છે. રજિસ્ટર કંપનીઝ, ગુજરાતના કાર્યાલય દ્રારા સંચાલિત કંપનીના રજિસ્ટરમાં શાહી મનીચેન્જર પ્રાંતિ અમદાવાદ ખાતેના માનનીય એનસીએલટી,બેચના આદેશ અનુસાર, ગુજરાતના રજિસ્ટ્રાર કંપનીઝની કરોરી દ્વારા संचावित रिष्टारमां मेसर्स **शाही मनीयेन्षर प्रा.बि.** तरीडे, ઉपरोडत डंपनीनं નામ પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે.

ક્થળ : અમદાવાદ તારીખ : ૨૮/૦૧/૨૦૨૦ અબુબકર મોહંમદ ચાકુબ ચુનાવાલ કડચા અધિકારી

COMPANY NOTICE GLAXOSMITHKLINE CONSUMER HEALTHCARE LIMITED CIN: L24231PB1958PLC002257

Registered Office: Patiala Road, Nabha 147 201 (Punjab) Tel No.: 01765 306400 Email Id: investor.2.co@gsk.com Fax No.: 01765 220642 Website: www.gsk-ch.in

Pursuant to Regulation 29 & 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, February 06, 2020 at the Corporate Office of the Company at 24th & 25th Floor, One Horizon Centre, DLF Phase – V, Golf Course Road, Gurugram 122 002, inter-alia to consider and take on record the Unaudited Financial Results for the third quarter ended on December 31 2019 with Limited Review done by Statutory Auditors.

The Notice of the above meeting is available on the Company's website www.gsk-ch.in and also on the website of the respective stock exchange(s) i.e. www.bseindia.com and www.nseindia.com

Place: Gurugram Date: 28.01.2020

For GlaxoSmithKline Consumer Healthcare Ltd. Shanu Saksena Company Secretary

000 NOUVELLE

DCM NOUVELLE LIMITED Registered office: 407, Vikrant Tower, 04, Rajendra Place, New Delhi-110008 Corporate Identity Number: L17309DL2016PLC307204 Phone: 011-43678490

E-mail: dcmnouvelleltd@gmail.com, Website: www.dcmnvl.com

NOTICE

Pursuant to Regulation 29 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, it is hereby informed that a meeting of the Board of Directors of the Company will be held on Wednesday, February 05, 2020, to consider and approve, the unaudited financial results for the quarter/nine months ended December 31, 2019.

The information contained in this notice is also available on the Company website www.dcmnvl.com and on the website of Stock Exchanges, i.e. www.nseindia.com and www.bseindia.com.

Place : New Delhi Dated: January 27, 2020

For **DCM Nouvelle Limited** Kunal Agrawal **Company Secretary**

વેચાણ નોટીસ ચારભુજા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ (ફડચામાં) _{ફડચા અધિકારી:} શ્રી અનિલ ગોએલ

ફડ્યા અધિકારીનું સરનામું: ઇ-૧૦એ, કૈલાશ કોલોની, ગ્રેટર કૈલાશ-૧ નવી દિલ્હી.-૧૧૦૦૪૮. ઇમેઇલ આઇડી: assetsale1@aaair olvency.in, assetsale1@aaa

anilgoel@aaansolvency.com કોન્ટેક્ટ નં .: +૯૧૮૮૦૦૮૬૫૨૮૪ (શ્રી પુનિત સચદેવા/અસિક્ ખાન),(૦૧૧) ૪૬૬૬ ૪૬૧૯, ઇન્સોલ્વેન્સી અને બેંક્રપ્ટરી કોક, ૨૦૧૬ હેઠળ અસક્યામતોનું ઇ–૯૨૧જી વેચાણ ઇ–હરાજીની તારીખ અને સમય:૧૪ મી ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ બપોરે ૩.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી (પ્રતિદિઠ ૫ મિનીટના અમર્ચાદિત વધારા સહીત)

માનનીય કંપની લો ટ્રીબ્યુનલ, મુંબઇ દ્વારા તારીખ ૦૨ મે, ૨૦૧૯ના આદેશ (ફડચા અધિકારીને ૦૮ મે, ૨૦૧૯ન રોજ જાણ કરાઇ હતી) મુજબ નિમાયેલ ફડ્યા અધિકારી દ્વારા રચાયેલ લીક્વીડેશન એસ્ટેટનો ભાગ બનતી ચારભુજ हान्द्रस्टी अपाहते हु लीभी हैं र (इस्यामां) नी भाली ही नी अभे हो अने भिल हतो ने वेयाण

વેચાણ ઇ-હરાજી પ્લેટફોર્મ https://aaa.auctiontiger.net મારફત નીચે સહી કરનાર દ્વારા કરવામાં આવશે

44191 0-8419 41col4 Hilps://ada.auctionliger.net 4145	ા પાચ ર	ાહા કરપાર	હારા કરવા	ના આવસ.
અસક્ચામતો	બ્લોક	અનામત કિંમત	ઇએમડીની ૨કમ	વૃદ્ધિ દર
ગામ વેરાવળ, (ગોંડલ રોડ), તાલુકો કોટડા, સંગાણી, જિક્ષો રાજકોટ, ગુજરાત- ૩૬૦૦૨૫ ના પ્લોટ નં. ૧૦ અને ૧૧, રીવર્સ સર્વે નં. ૧૮૭ ખાતે આવેલ કૌહોલ્ડ જમીન અને બિલ્ડીંગ	એ	૪.૨૮ કરોડ	૪૨.૮ લાખ	ર લાખ
ગામ વેરાવળ, (ગોંડલ રોડ), તાલુકો કોટડા, સંગાણી, જિક્ષો રાજકોટ, ગુજરાત- ૩૬૦૦૨૫ના પ્લોટનં.૧૦અને૧૧, રીવર્સસર્વેનં.૧૮૭ની રાજકોટપ્રીમાઇસીસ ખાતે પ્લાન્ટ અને મશીનરી (પીનટ પ્રોસેસીંગ પ્લાન્ટ)		ર.દ્ ર કરોડ	રદ્દ.ર લાખ	ર લાખ
ગામ વેરાવળ, (ગોંડલ રોડ), તાલુકો કોટડા, સંગાણી, જિક્ષો રાજકોટ, ગુજરાત- ૩૬૦૦૨૫ ના પ્લોટ નં. ૧૦ અને ૧૧, રીવર્સ સર્વે નં. ૧૮૭ ખાતે આવેલ ક્ષીહોલ્ડ જમીન અને બિલ્કીંગ		ફ.૯૧ કરોડ	ફ૯.૧ લાખ	પ લાખ
યુ-૧૦૩, યુ-૧૦૪ અને યુ-૧૦૫/૨, ગામ નિલદોહ, તાલુકો હિંગાણા, જિક્ષો નાગપુર- ૪૪૦૦૧૬, મહારાષ્ટ્ર(મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસે ૯૫ વર્ષથી ભાડા પેટે) ખાતે આવેલ જમીન (ભાડાપેટે) અને ભિલ્ડીંગ.		૨.૪૧ કરોડ	૨૪.૧ લાખ	ર લાખ
યુ-૧૦૩, યુ-૧૦૪ અને યુ-૧૦૫/૨, ગામ નિલદોહ, તાલુકો હિંગાણા, જિક્ષો નાગપુર- ૪૪૦૦૧૬, મહારાષ્ટ્ર ખાતે નાગપુરપ્રીમાઇસીસ ખાતે આવેલ પ્લાન્ટ અને મશીનરી (કુડ ઓઇલ એક્ઝોટીક ફેટ્સ રીક્ષઇનરી)		૧.૫૬ કરોડ	૧૫.ફ લાખ	ર લાખ
યુ-૧૦૩, યુ-૧૦૪ અને યુ-૧૦૫/૨, ગામ નિલદોહ, તાલુકો હિંગાણા, જિક્ષો નાગપુર-૪૪૦૦૧૬, મહારાષ્ટ્ર(મહારાષ્ટ્ર હન્સ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસે ૯૫ વર્ષથી ભાડા પેટે) ખાતે આવેલ જમીન (ભાડા પેટે) અને બિલ્ડીંગ તેમજ પ્લાન્ટ અને મશીનરી.		3.6૮ કરોડ	36.૮ લાખ	પ લાખ
ઓકીસ નં. ૫૦૨ અને ૫૦૩, પાંચમો માળ, અભય સ્ટીલ હાઇસ પ્રીમાઇસીસ કો-ઓપ- સોસાયટી લીમીટેડ, મસ્જીદ બંદર (પુર્વ), મુંબઇ– ૪૦૦૦૦૯ ખાતે આવેલ ઓફીસ પ્રીમાઇસીસ	Ŋ	૧.૦૩ કરોડ	૧૦.૩ લાખ	ર લાખ
ગામ માંડવા, તાલુકો-હિંગાણા, જિજ્ઞો નાગપુર ખાતે આવેલ ભાડાપેટાની ખુજ્ઞી જમીન માં આવેલ પ્લોટ નં. જે-૧૯/૨	એચ	૧.૭૩ કરોડ	૧૭.૩ લાખ	ર લાખ

<u>ઇ–**હરાજીની શરતો અને નિયમો નીચે મુજબ છે:**</u> ૧. ઇ– હરાજી માન્ય સર્વિસ પ્રદાતા મેસર્સ ઇ-પ્રોક્યુ રમેન્ટ ટેકનોલોજી લીમીટેડ (ઓક્શન ટાઇગર) મારકત જ્યાં છે. જે છે. અને જેમ છે ના ધોરણે કરવામાં આવશે.અસક્યામતોની વિગતો ધરાવત સંપુર્ણ ઇ-હરાજી પ્રક્રિયાના દસ્તાવેજો, ઓનલાઇન ઇ-હરાજી બીડ ફોર્મ, ડીક્લેરેશન અને અન્ડરટેકીંગ ફોર્મ, ઓનલાઇન હરાજી વેચાણની સાધારણ શરતો અને નિયમો વેબસાઇટ https://aaa.auctiontiger.net પર ઉપલબ્ધ રહેશે. સંપર્ક : શ્રી તિલક મરાઠ + ૯૧-૬૩૫૧૮૯૬૮૩૪/૦૭૯૬૧૨૦૦૫૮૬/૮૪, tilak@auctiontiger.net/support@auctiontiger.net (લિં nttps://aaa.auctiontiger.net ૫૨ જઇને રસ ધરાવતા બીડરો (૧) કંપનીનું નામ (ચારભુજા ઇન્ડસ્ટ્રીઝપ્રાઇવેટ લીમીટેડ) અથવ

https://aaa.auctiontiger.net પર જઇન રસ ધરાવતા બી.ડરી (૧) કંપનીનું નામ (ચારભુજા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવટ લીમીટડ) અથવા ((૨) સ્ટેટ અને પ્રોપર્શ ટાઇપ બેમાંથી એક વિકલ્પ પસંદ કરીને જણાવેલ કંપની માટે સર્ચ કરી શકશે.)

૨. રસ ધરાવતા બી.ડયેએ તેમની બી.ડે સુપરત કરતા પહેલા મિલકતત્તા ટાઇટલ, સ્થાનિક વેસ, ઇલેક્ટ્રીસીટીના બાકી લેણાં અને પાણી ચાર્જ, મેઇન્ટનન્સ ચાર્જ, જો કોઇ હોય તેના અંગે સ્વતંત્ત પૂછપરછ કરી લેવી જોઇએ અને તેમના પોતાના ખર્ચ મિલકતનું નિસ્ક્રિય કરી વર્લું જોઇએ અને તેમના પોતાના ખર્ચ મિલકતનું પાણી ચાર્જ, મેઇન્ટને સ્વાર્થ કરી લેવો જોઇએ હપર જણાવેલ મિલકતો આપોતાને મુલાકાત લઇને સાઇટ પર ભાવી બી.ડરો નિસ્ક્રિય કરી છે કે છે. સંપર્ધ : શ્રી પુનીત સચલેવા/અસિફ ખાન (+૯૧૮૦૦૦૦૮૬૫૨૮૪).

૩. રસ ધરાતતા બીડરોએ ચારભુજા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇલેટ લીમીટેકના એકાઉન્ટરમાં, એકાઉન્ટ નં. ૫૦૨૦૦૦૪૦૬૨૨૦, એચે ચેએક્સી બેક, આઇએક્ટ એસી. કોક: HDFC000092, બી.નપ પ્રે એ, એટ કેલા શ. ૧ નવી દિલ્હી, ૧૧૦૦૪૮ મા ડી.પ્રીએનેઇએકટી/આડડીજીએસ ક્રારા અથવા ચારભુજા ઇન્ડસ્ટ્રીઝપા. લી. કડ્યામાનાં નામે કોઇપણ શ્રી બ્રુલ્ડ બેકના નામે આપેલ ડી.ક્રી કારો અલ્લા સંપૂર્ણ ઇન્ડ-ચઇ પ્રક્રિયા સ્વાર્થ માર્ચ છે અંગ કરી કરો કરો બી અનુસાર ઇએમડીની દરમ માટે બેંક ગેરંટી આપીને અનેસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી) જયા કરવી જરૂરી છે. ૪.સ્સ ઘરતાતા બીડરોએ ઇન્ડ સાજીમાં ભાગ લેવા માટે ઇએમડી ડીપોઝીટ અથવા બેંક ગેરંટી અને રીક્લેસ્ટ લેટરની સાથે સાથે લ

૪.૨સ ધરાવતા બીડરોના ઇન્હરાજીમાં ભાગ લવા માટે ઇમ્પેયી ડીપાઝીટ અથવા બંક ગરટી અને રીકનસ્ટ લેટરની સાથે સાથે (૧) ઓળખના પૂરાવા (૨) ચાકુ સરનામાના પુરાવા (૩) પાન કાર્ડ (૪) ચોગ્ય ઇપોઇલ આઇડી (૫) તેન્હાઇન અને મોબાઇલ કોન નંબર (૬) એકીરોવીટ અને અંડરટેકીંગ, જોડાણ ૧(૭) બીડ એપ્લિકેશન ફોર્મ અનુસાર, છોડાણ ૨ (૮) અનુસાર બીડરોના નિવેદન, જોડાણ ૩ અનુસાર સુપરત કરવાના રહેશે, આ જોડાણોની ફોરમેટો સંપૂર્ણ ઇન્હરાજી પ્રદેશ દસ્તાલેજોમાંથી લઇ શકાશે, આ કારતારે લેક કરા અધિકારી કરાયો લેક સાથે પાટે પર ૧ કે ક્રુંબારી, ૦૨૦૦ ના રોજ સાજે પાટે ૦૦ પહેલા પહોંચવા જોઇએ. રસ ઘરાવતા બીડરોએ તેમના કેવાયસી દસ્તાલેજો તેમજ ઇએમડી જમા કર્યાની રહેશે, પાત્ર લાય કબીડરોના નામ (https://aaa.auctiontiger.net) પોર્ટલ પર ૧ કે ક્રુંબારી, ૨૦૨૦ ના રોજ સાજે પાટે ૦૦ પહેલા અપલોડ કરવાની રહેશે, પાલાયક બીડરોના નામ (https://aaa.auctiontiger.net) પોર્ટલ પર ૭-હરાજીમાં ભાગ લેવા માટે કડ્યા અધિકારી દ્વારા ઓળખવામાં આવશે. ઇન્હરાજી અનિ પ્રદાતા (ઓક્શન ટાઇગર) લાયક બીડરોના ઇમેઇલ દ્વારા યુઝર આઇડી અને પાસવાર્ડ પૂરા

પડકા. ૬. જો ઇ~હરાજી સમાપ્ત થવાની સમયની છેશ્રી પ મીનીટમાં બીડ કરવામાં આવશે તો બંધ થવાનો સમય આપમેળે પ મીની. અમર્યાદીત લંબાણથી વધી જશે. ઇ~હરાજી પ્રક્રિયાની સમાપ્તિ પર સૌથી ઉચી બીડ રકમ જમા કરાવનાર બીડર (રીઝર્વ કિમંતર્થ ઓછી નહી)ને સફળ બીડર જાહેર કરવામાં આવશે અને તે બાબતની જાણ ઇલેક્ટીક માધ્યમથી કરવામાં આવશે જે ફડ્યા અધિકારીને હું હતી કે. જિ

૭. સફળ બીડરની ઇએમડી વેચાણની ગણતરીના ભાગરૂપે જાળવી રાખવામાં આવશે અને અસફળ બીડરોની ઇએમડી પરત કરવામ તાવશે. ઇએમડી પર ક્રોઇ વ્યાજ મળશે નહી. ફડ્યા અધિકારી સફળ બીડરને લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) જારી કરશે અને સફળ બીડરે બાકીની ૨કમ (સફળ બીડ ૨કમ - ઇએમડી ૨કમ) ફડ્યા અધિકારી દ્વારા એલઓઆઇ જારી કર્યાના ૩૦ દિવસર્ન અંદર જમા કરવાની રહેશે. સફળ બીડર દ્વારા ઉપર જણાવેલ સમય મર્યાદમાં બાકીની ટકળ જમા કરવામાં કસુરના કિસ્સામાં, ૧ કરાવાયેલ તમામ રકમ (ઇએમડી + કોઇ અન્ય રકમ) જમ કરવામાં આવશે.

૮. સફળ બીડરે લાગુ સ્ટેમ્પ ડ્યુટીઝ/ ટ્રાન્સફર ફી અને હરાજી પર મુકાયેલ મિલકતને સબંધિત સ્થાનિક વેરા, ડ્યુટી, દર, એસેસમેન

૯. કડ્યા અધિકારી કોઇપણ કારણ જણાવ્યા વગર કોઇપણ સ્તરે કોઇપણ અથવા તમામ ઓકર(રો) નો સ્વીકાર કે રદ અથવા -હરાજી મોકુક/સ્થગિત/રદ કરવાનો અથવા હરાજી પ્રક્રિયામાંથી કોઇપણ મિલકત અથવા તેનો કોઇ ભાગ રદ કરવાનો અબાધિ હક ધરાવે છે

૧૦. સમગ્ર વેચાણની રકમની ચુકવણી પછી, વેચાણ સર્ટીફીકેટ/એગ્રીમેન્ટ ફક્ત સફળ બીડરના નામે જ જારી કરવામાં આ અને કોઇ અન્ય નામે જારી કરવામાં આવશે નહી.

૧૧. વેચાણ ઇન્સોલ્વેન્સી અને બેંક્રપ્ટસી કોડ, ૨૦૧૬ અને તે હેઠળ બનેલ નિયમનોની જોગવાઇઓને આધિન રહેશે ૧૨. જો એક કરતા વધુ બીડરો ઇએમડી ભરતા નથી, તો તેવા કિસ્સામાં ફડ્યા અધિકારી સ્ટેકહોલ્ડરો સાથે પરામર્શ કર્યા પછ

હરાજી પ્રક્રિયા રદ કરવાની સંપુર્ણ સત્તા ધરાવશે. ૧૩. રસ ધરાવતા બીડર(રો) ને કંપનીના કામકાજ અને સંચાલનોનું કામ કરવાના હેતુથી ફડચા અધિકારી વતી કાર્ય કરતી કંપન દ્વારા સુસ્થાપિત અને સંચાલિત ડેટા રૂમ (ડેટા રૂમ) મીં પ્રવેશ આપવામાં આવશે. રસ ઘરાવતા બીડરો ઇ-હરાજી તારીખ સુધી ડેટ

રૂમની માહિતીમાં પ્રવેશ પુરો પાડવામાં આવશે. રસ ધરાવતા બીડર(રો) દ્વારા ડેટા રૂમમાં માહિતીનો ઉપયોગ સમયે સમયે ફડ્ય . અધિકારી દ્વારા જણાવેલ નિયમનો અનુસાર રહેશે ૧૪. ઇ-હરાજી તારીખ અને સમય:૧ં૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ બપોરે ૩.૦૦ થી ૫.૦૦ સુધી (૫ મીનીટના અમર્યાદિત લંબાણ સહીત)

અનિલ ગોએલ ચારભુજા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડની બાબતમાં ફડચા અધિકાર્ર

IBBI(Regn.N0-(IBBI/IPA-001/IP-00118/2017-18/10253 સરનામુ: ઇ-૧૦એ, કૈલાશ કોલોની, ગ્રેટર કૈલાશ -૧, નવી દિલ્હી- ૧૧૦૦૪ સ્થળ : નવી દિલ્હી સંપર્ક નં. : + ૯૧ ૮૮૦૦૮૬૫૨૮૪ (શ્રી પુનિત સચદેવા/અસિફ ખાન) : ૦૧૧ ૪૬૬૬ ૪૬૧૯



Gujarat State Financial Corporation Secretarial Cell Block No.10, Udyog Bhavan, Sector-11, GH-4, Gandhinagar – 382 010 Phone: (079) 23256766 Fax: (079) 23252204 Website: www.gsfc.gujarat.gov.in E-mail: sec-cell-gsfc@gujarat.gov.ir

Notice is hereby given, pursuant to Regulations 29 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Corporation will be held on **Monday**, the 10" February, 2020 at 1.00 pm in the Committee Room of Industries & Mines Department, Block No. 5, 3rd Floor, Sachivalaya, Gandhinagar to approve, inter alia, the unaudited financial results of the Corporation for the nine months/quarter ended 31st December, 2019. The intimation to BSE Ltd is available on the websites of the Corporation (www.gsfc.gujarat.gov.in) and BSE Ltd (www.bseindia.com). Place : Gandhinagar for Gujarat State Financial Corporation, Date : 27/01/2020 Secretary (Board)



Database

Interested parties may refer Bank's

Website

https://www.indianbank.in/tenders

for details

NOTICE

inter-alia, to consider and approve the

Un-audited Financial Results of the

Company for the quarter and nine months

The said notice is also available

on the website of the Company i.e

www.jindal.com and the Stock exchanges i.e.

www.bseindia.com and www.nseindia.com.

For JINDAL DRILLING AND INDUSTRIES LTD

JINDAL.

ચુકવવા જણાવ્યું હતું.

८९०. पश्चिम: टेनामेन्ट नं.८८० તારીખ : ૨૨.૦૧.૨૦૨૦

SOVERNMENT OF TAMIL NADU / WATER RESOURCES DEPARTMENT

TNIAM PROJECT

REQUEST FOR BIDS (RFB) (One-Envelope Bidding Process without e-Procurement)

For Procurement of Goods / Equipments

NATIONAL OPEN COMPETITIVE PROCUREMENT

Bid Invitation No.: 06/PBC/2019-20/2020/ DATED: 24.01.2020

The Government of India has received financing from the World Bank toward the cost of the TamilNadu Irrigated Agriculture Modernisation Project (IAMWARM - II) and intends to apply part of the proceeds toward eligible payments under the contract for Procurement of Goods / Equipments

Bidding will be conducted through national open competitive procurement using a Request for Bids (RFB) as specified in the World Bank's

"Procurement Regulations for IPF Borrowers, July 2016_Revised August 2018", ("Procurement Regulations") and is open to all Bidders as defined

Bidders from India should, however, be registered with the Government of Tamilnadu Under class I (State level) or other State

Governments/Government of India, or State/Central Government Undertakings. Bidders from India, who are not registered as above, on the date of the contract $bidding, can also \ participate \ provided \ they \ get \ themselves \ registered \ by \ the \ time \ of \ contract \ signing, \ if \ they \ become \ successful \ bidders.$

The Water Resources Department, Government of Tamil Nadu, For and on behalf of Governor of Tamil Nadu, The Superintending

Engineer, PWD., WRD., Palar Basin Circle, Chepauk, Chennai-5, Chennai District, Tamil Nadu now invites sealed Bids from eligible Bidder

for the Procurement of Goods / Equipments detailed below in the table. Interested bidders may obtain further information and inspect the bidding

document at the address given below during office hours. Bidders are advised to note the clauses on eligibility (Section I Clause 4) and minimum

qualification criteria (Section III - Evaluation and Qualification Criteria), to qualify for the award of the contract. In addition the "Procurement

The bidding document may be purchased by interested eligible Bidders from the office of The Superintending Engineer, PWD., WRD.

Palar Basin Circle, Chepauk, Chennai-5, Chennai District, Tamil Nadu from 29.01.2020 to 27.02.2020 upon payment of a non-refundable fee

(three sets) as indicated in the table below, in the form of Demand Draft (DD) on any Scheduled/Nationalized bank payable at Chennai in favour o the Executive Engineer, PWD, WRD, Krishna Water Supply Project Division - I, Chepauk, Chennai - 5. Bidding document requested by mai

will be dispatched by courier/speed post on payment of an extra amount of Rs.500/-. The Superintending Engineer, PWD., WRD., Palar Basin

Circle, Chepauk, Chennai-5, Chennai District, Tamil Nadu will not be held responsible for the postal delay if any, in the delivery of the document

 $or non-receipt of the same. \textbf{The bidding documents can be downloaded from the website http://www.tenders.tn.gov.in \\ at free of cost. In such that the same is the bidding document of the bidding$

Bids must be delivered to The Superintending Engineer, PWD., WRD., Palar Basin Circle, Chepauk, Chennai-5, Chennai District, Tami

Nadu on or before 3.00 PM on 28.02.2020 and will be publicly opened on the same day at 3.30 PM, in the presence of the Bidders' designated

representatives. If the office happens to be closed on the date of receipt of the bids as specified, the bids will be received and opened on the ne

All Bids must be accompanied by a Bid Security of the amount specified for the work in the table below, drawn in favour of the Executive Enginee

PWD, WRD, Krishna Water Supply Project Division - I, Chepauk, Chennai - 5. Bid security will have to be in any one of the forms as specified in

: Er. A. Muthaiya, B.E., Superintending Engineer

Palar Basin Circle, Chepauk, Chennai - 5.

SAURARH AGRAWAI

Membership No.:A36163

इंडियन बेंक ईडियन बक Indian Bank

Company Secretary

પરિશિષ્ટ - IV (નિચમ ૮(૧)) કબજા નોટિસ (સ્થાવર મિલકત માટે)

આથી સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ

એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ २००२ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ

(એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિચમ ૮ અને ૯ સાથે વંચાતી ક્લમ ૧૩ (૧૨) હેઠળ

પ્રાપ્ત સત્તાની રૂએ નીચે સહી કરનાર ઈન્ડિયન બેન્કના અધિકૃત અધિકારીએ **તા.** ૧૧.૧૧.૨૦૧૯ ના રોજ માંગણા નોટિસ જારી કરી અમારી શાહીબાંગ શાખામાં એકાઉન્ટ

ધરાવતા દેવાદાર **શ્રી દિનેશ જે. કમલીયા (મે. હિના હેન્ડીક્રાફ્ટ ના દેવાદાર/**

દ્રપ૮૭૪૮૯૩૪૦ ની ₹ ૧૮,૪૮,૯૯૮/- (₹ અઢાર લાખ અડતાળીસ હજાર નવસો અક્રાણું **પુરા)** અને પરત ચુકવણી સુધીની **તા. ૦૬.૧૧.૨૦૧૯** થી સંમત થયેલ દરે તેના પરનું

આગળનું ચડત વ્યાજ સહિત જણાવેલ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર પરત

દેવાદાર આ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર અને જાહેર

જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સદરહુ રૂલ્સના

नियम ८ अने ६ साथे वंयाती सहरहु એક्ટनी इसम 93(४) हेडल तेमने/तेणीने

પ્રાપ્ત સત્તાની રૂએ નીચે દર્શાવેલી મિલકતનો તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને આથી આ મિલકત અંગે કોઈ વ્યવહાર ન કરવા સાવધ કરવામાં આવે છે અને આ મિલકત સાથે કોઈ પણ વ્યવહાર કરાશે તો તે ઈન્ડિયન

બેંકની કુલ ૨કમ ₹ ૧७,૪૩,૧૫૫/- (બુક બેલેન્સ ₹ ૧૬,૦૮,૦૮૩/- + એમઓઆઈ બાકી ₹

૧,૩૫,૦७२/-) ૨૧.૦૧.૨૦૨૦ મુજબની ૨કમ તથા તેના પરના આગળના વ્યાજ, કોસ્ટ,

સ્થાવર મિલકતનું વર્ણન મોર્ગેજ્ડ એસેટ્સ : ગામ ચાંદખેડા, તા. સાબરમતી, જિ. અમદાવાદ ગુજરાત ખાતે આવેલ એસ નં. ૫૩૩ વાળી જમીનના ૪૧.૮૧ ચો.મી. માપના ટેનામેન્ટ નં. સી-૮૭૧ જનતા નગર પાર્શ્વનાથ, ચાંદખેડા, અમદાવાદ-૩૮૨૪૨૪ વાળી મિલકતના બધા પીસ अने पार्सल. **ઉत्तर:** टेनामेन्ट नं. ८९२, **६क्षिण:** टेनामेन्ट नं. ८९०, **पुर्व:** टेनामेन्ट नं

અન્ય ચાર્જિસ તથા ખર્ચા સહિતની રકમના ચાર્જને આદ્યિન રહેશે.

પ્રોપરાઈટર) (દેવાદાર / ગીરવેદાર) ને નોટીસમાં જણાવેલ ૨કમ લોન ખાતા ન

ended 31st December, 2019.

27.01.2020

Indian Bank, a leading Public Secto Where service is a way of life Bank, is interested in implementing TENDER NOTICE Tokenization of Debit Card Numbers Stored in HP Non Stop Server

Sealed tenders are invited for "Reques for proposal for selection of vendor or supply, installation, commissioning & maintenance of Passbook Printing Rate Contract". For specifications & other relevant details, RFP may be downloaded from Bank's website www.psbindia.com. Any further changes related to the said Tender shall be posted on bank's website only.

DGM-IT



MAHARASHTRA SEAMLESS LIMITED

CIN: L99999MH1988PLC080545 Regd. Off.: Pipe Nagar, Village- Sukeli N.H.17, B.K.G. Road, Taluka Roha, Distt. Raigad - 402126, Maharashtra

Phone No.: 02194-238511 E-mail: secretarial@mahaseam.com Website: www.jindal.com NOTICE

Notice is hereby given pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015, as amended from time to time, that a meeting of the Board of Directors of Company is scheduled to be held on Friday, 7th February, 2020, inter-alia, to consider and approve the Un-audited Financial Results of the Company for the quarter and nine months ended 31st December, 2019.

The said notice is also available on the website of the Company i.e www.jindal.com and the Stock exchanges i.e. ww.bseindia.com and www.nseindia.com For MAHARASHTRA SEAMLESS LTD

D. C. GUPTA Gurugram 27.01.2020 V.P. & Company Secretary JINDAL

અમદાવાદ, મંગળવાર, તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૦

THE TRAVANCORE-COCHIN CHEMICALS LIMITED (A GOVERNMENT COMPANY), P.B. No. 4, Udyogamandal P.O. Kochi-683501, Kerala, India. Ph: 0484 -2545011, E-mail: projects@tcckerala.com Website:www.tcckerala.com

NOTICE INVITING TENDER Online bids (E-tender) are invited from reputed firms for the supply of the following through

Kerala government e tender portar neep.// etenders.kerala.gov.iii						
SI No.	Name of work	Tender ID	Last date of Submitting tender			
1.	Supply of CS Diaphragm Valves of various sizes with PTFE/PFA/F46 lining	2020_TCCL_338318_1	06/02/2020			
2.	Supply of CS Butterfly Valves of various sizes with PTFE/PFA/F46 lining	2020_TCCL_338263_2	06/02/2020			
All the relevant details and the tender document can be downloaded from the site						

Amendments / Corrigendum if any will be published only in the website. Sd/- Dy. General Manager (Projects

WELCAST STEELS LIMITED CIN: L27104GJ1972PLC085827

Regd. Office: 115-116, G.V.M.M. Estate, Odhav Road, Ahmedabad 382 415 Ph. 079-22901078. Fax: 079-22901077. Website: www.welcaststeels.com, Email: info@welcaststeels.com

n-audited standalone financial results for the Quarter / Nine months ended 31st December, 2019 JINDAL DRILLING AND (₹ in Lakhs) **INDUSTRIES LIMITED** Quarter ended **Particulars** Ended CIN: L27201MH1983PLC233813 31.12.2019 31.12.2018 31.12.2019 Regd. Off.: Pipe Nagar, Village- Sukeli, N.H.17, B.K.G. Road, Taluka Roha, Unaudited Unaudited Unaudite Distt. Raigad - 402126, Maharashtra Total income from operations 3.895.59 6.212.56 11.748.69 Phone No.: 02194-238511 Net Profit /(Loss) for the period E-mail: secretarial@jindaldrilling.ir (before Tax, Exceptional and/or Extraordinary items) (25.59)79.16 37.08 Website: www.jindal.com Net Profit /(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) (25.59)79.16 37.08 Notice is hereby given pursuant to Regulation 47 of the Securities and Net Profit /(Loss) for the period after tax 40.18 (after Exceptional and/or Extraordinary items) (14.77)22.95 Exchange Board of India (Listing Total Comprehensive Income for the period Obligations and Disclosure Requirements [Comprising Profit/(Loss) for the period (after tax) and Regulations, 2015, as amended from time to time, that a meeting of the Board Other Comprehensive Income (after tax)] (0.93)1.19 2.95 of Directors of Company is scheduled **Equity Share Capital** 63.82 63.82 63.82 to be held on Friday, 7th February, 2020, Earnings Per Share(EPS) (of ₹ 10/- each)

(for continuing and discontinued operations)

શાહીબાગ શાખા :3, ૪, ૫, શેવલ રેસીડેન્સી, ગિરધર નગર,

શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪

અધિકૃત અધિકારી र्धेन्डियन બेन्ड

ङोन : e४२७**५२**५४०५ / ८१४७१८८४४२

a. Basic & Diluted EPS before Extra ordinary items (In ₹)

b. Basic & Diluted EPS after Extra ordinary items (In ₹)

Note: 1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter/Nine months ended December 31st, 2019 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The Full format of the Financial Result for the Quarter/Nine months ended Decembe 31st, 2019 are available on the Stock Exchange website (www.bseindia.com) and Company's website (www.welcaststeels.com) By Order of Board of Directors For WELCAST STEELS LTD.

(2.31)

(2.31)

6.30

6.30

3.60

3.60

Vinod Narain Place: Bengaluru Date: 27th January, 2020 DIN: 00058280

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

एनरीपीसी NTPC Limited

CIN: L40101DL1975GOI007966

Regd. Office: NTPC Bhawan, SCOPE Complex, 7 Institutional Area, Lodi Road, New Delhi-110 003 Tel. No. 011-24360071, Fax: 011-24360241, E-mail: csntpc@ntpc.co.in, Website: www.ntpc.co.in

NOTICE OF BOARD MEETING AND FIXATION OF RECORD DATE Pursuant to Regulation 29 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI LODR Regulations, 2015), notice is hereby given that the unaudited Financial Results for the quarter and nine-months period ended December 31, 2019 shall be approved and taken on record by the Board of Directors of the Company at its Meeting scheduled to be held at New Delhi on **Friday**, February 7, 2020, after these results are reviewed by the Audit Committee of the Board. Interim dividend on the equity share capital of the Company for the year 2019-20 may also be, inter-alia, considered in the same Meeting of the Board of Directors.

Notice is further given that the Company has fixed Monday, February 17, 2020 as the "RECORD DATE" for the purpose of ascertaining the eligibility of the shareholders for payment of above interim dividend, if declared by the

The Interim Dividend, if declared, shall be paid to those eligible members or their mandates whose names appear:

(a) as Beneficial Owners as at the close of business hours on Monday, February 17, 2020 as per the list of Beneficial Owners to be furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited in respect of the shares held in Electronic/Demat form,

(b) as Members in the Register of Members of the Company after giving effect to all transactions in physical form lodged on or before **Mo**

February 17, 2020. The said Notice and any other further information may be accessed on the Company's website at https://www.ntpc.co.in/ and may also be accessed

on the Stock Exchanges' website at https://www.bseindia.com/ and https://www.nseindia.com. Further, in terms of Code for Prevention of Insider Trading in the Securities of the Company, the Trading Window for transactions in the securities of the Company which was closed from January 1, 2020 shall remain closed until

February 9, 2020 for the purpose of announcement of aforesaid results.

Requests for transfer, communication for change of address, Bank details, and ECS details should be sent to the respective Depository Participants of the shared held is should be sent to the respective Depository Participants of the shared holders in case of dematerialised shares. The above details in respect of shares held in Physical form should be sent to the Registrar and Transfer Agents of the Company at the following address:

Alankit Assignments Limited, Unit: NTPC Limited Alankit House, 4E/2, Jhandewalan Extension, New Delhi - 110055

Members holding equity shares of the company in electronic mode, who have not registered their e-mail address, are requested to register their e-mail address through their Depository Participant (DPs) to enable us to send documents through electronic mode in future. Members who have registered their e-mail-ID are requested to keep it validated with their DP.

Members holding equity shares in physical form, who have not registered their e-mail address, are requested to register their e-mail address with Alankit Assignments Limited, Registrar and Share Transfer Agent of the Company, to enable us to send document through electronic mode in future For NTPC Limited

Sd/-(Nandini Sarkar)

ક્શિમઃ પાસેનો પ્લોટ નં. ૧૯૯, ઉત્તરઃ પ્લોટ નં. ૧૬૮

દક્ષિણ: પાસેનો પ્લોટ નં.૧૭૦

Dated: 27.01.2020 Leading the Power Sector

RELIGÂRE I HOME

Company Secretary

લીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાચનાન્સ કોર્પોરેશન લીમીટેડ ૧ઝુસ્ટર્ડ ઓફીસ: બીજો માળ, રાજલોક બિલ્કીંગ, ૨૪ નેહરૂ પેલેસ, નવી દિલ્હી –૧૧૦૦૧૯ મેન્ટ્રલ ઓફીસ : પહેલો માળ, પીર્ચસ ગ્લોબલ ટાવર, એ-૩, ૪, ૫, સેક્ટર-૧૨૫, ભારત–૨૦૧૩૦૧ સિક્ચોરીટાઇ)શન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ૧૩ (૨) હેઠળ નોટીસ

Place: New Delhi

અમે રેલીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ કાયનાન્સ કોર્પોરેશન લી.. અમારા અધિકત અધિકારી મારકત સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્શન ઓક કાયનાન્સિયલ એનકોર્સમેન બોફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨)હેઠળ માંગણા નોટીસ જારી કરી છે. જે તમારા દ્વારા મુળી અને વ્યાજ વગેરેના હપ્તાઓની ચુકવણીમાં કરાયેલ કસૂર વિગતો ધરાવે છે. બાકી લેણાંની રકમ નીચે જણાવ્યા મુજબ છેઃ ક્રમ દેવાદર/સહ- લોન એકા. ૧૩(૨) મેળવેલ કલમ૧૩(૨)

	٠ ا.	દેવાદારનાં નામ	નંબર	નોટીસની તારીખ	નેળવલ લોનની રકમ	નોટીસ મુજબ માંગણાની રકમ	સરનામું	5	મિલકત
	1.	૧. આકાશ મનોજ થાટે જે મનોજ	XMHDSRH 00079331 (Applicatio	79331	5,03,130/-	Rs. 4,87,366.23/- (રૂપિયા ચાર કરોડ	સ્વામીનારાયણ સોસ	ાચટી	. મોજે ગામ ગોડાદરા, સુરત શહેર, ગુજરાત-૩૯૫૦૧૦ ન રેવન્યુ સર્વે નં.૭૬/૨, બ્લોક નં.૮૨, ટાઉન પ્લાનિંગ સ્કીમ
		વૈસારાવ શાડુના પૈત્ર 🗼 u ID			સિત્યાંસી લાખ	પાસે, રેવન્યુ સર્વે નં.		નં. ફુલ્, ફાઇનલ પ્લોટ નં.૧૫ ખાતે આવેલ ધિરુજનગર	
		ર. મનોહર ટી. થાટે જે 67051			ત્રણસો છાંસઠ અને	બ્લોક નં.૮૨, ટાઉન પ		મ્યુન્સિપલ ટેનામેન્ટ નં. દૃપડી-૧૫-૧૦૦૧-૦-૦૦૧ ન	
		તુકારામ દુમંગી			ત્રૈવીસ પૈસા પુરા) ૦૯.૧૨.૨૦૧૯	સ્ક્રીમ નં. દૃ૯, ફાઇનલ		સાઇટ મુજબ પ્લોટ નં. ૧૦૦ (મંજુર કરેલ પ્લાન મુજ	
		થાટેના પુત્ર 3. અનિતાબેન થાટે				મુજબ	નં.૧૫, મોજે ગામ ગોડ		પ્લોટ નં.૯૧)ની મિલકતના તમામ પીસ અને પાર્સલ ક્ષેત્રફળ ૩૯.૦૧૮ ચો.મી. ચતુ:સીમાઃ પૂર્વઃ પ્લોટ નં.૧૦૧
		3. સામલાળન વાટ જે મનોહર ટી. થાટેના પત્ની				નુવળ	સુરત, ગુજરાત-૩૯૫	1040	યશ્ચિમ: પ્લોટ નં. ૯૯, ઉત્તર: ૧૫ કુટ રોડ, દક્ષિણ: પ્લોટ
								નાં. ૧૧૧ નં. ૧૧૧	
ł	2.	૧. અમલેશકુમાર	XMHDSRH	09.12.2019	Rs.	Rs. 4,33,094.66/-	પ્લોટ નં.૨૧, રૂમ	ફ્લેટ વ	 નં. ૪૦૯ ની મિલકતના તમામ પીસ અને પાર્સલ. ક્ષેત્રફળ
		સિંઘ જે બાદશાહ	00072878 (Applicatio		4,16,213/-	(રૂપિયા ચાર લાખ	નં.૨૦૪, એસટી	૨૫૬.૮	૦ ચો. ક્રુટ એટલે કે ૨૩.૮૬ ચો.મી. બિલ્ટ અ૫ એરિચ
		સિંઘના પુત્ર	n ID			ત્રૈતીસ હજાર ચોરાણું	એફઆઇ વિહાલ	ગ્રાઉન્ડ	s લેન્ડ, સો થો માળ, સુકુન રેસીડેન્સી–૩ માં ન વહેસાચેલ
		૨. સુમન સિંઘ જે	656463)			અને છાંસઠ પૈસા	નગર, સોસાયટી,	l	સહીત જે ગુજરાત, સુરત, પેટા જિલો અને તાલુકો પલસાણા
		અમલેશકુમાર				પુરા) ૦૯.૧૨.૨૦૧૯	વરાછા રોડ, સુરત,	l	ામ તાતીથૈયા, બ્લોક નં. ૨, ૪, ૫, ૧૧–એ, ૧૨, ૧૩–એ, ૧૪
		સિંઘના પત્ની				મુજબ	ગુજરાત ૩૯૫૦૦૬		દુ, ૩૯, ૪૦–એ, ૪૧, ૪૨, ૪૩, ૧૫૭, ૩૨૩–એ, ૩૨૫, ૩૨૬ (
							અહીં પણ: ફ્લેટ	l	પછી નવો બ્લોક નં. ૨) સોની પાર્ક હાઉસિંગ સોસાચટી –૨.
							નં.૪૦૯, ગ્રાઉન્ડ		ોટ નં. ૨૮૮, ૨૮૯, ૨૯૦, ૨૯૧ અને ૨૯૨૫કી, સુરત, ગુજરાત
							લેન્ડ, ચોથો માળ,		ાપ. ચતુઃસીમાઃ પુર્વઃ સોસાચટી કોમન રોડ, પશ્ચિમઃ પાસેનો
							સુકુન રેસીડેન્સી ૩,	l	નં. ૨૬૯, ૨૭૦ અને ૨૭૧, ઉત્તરઃ પાસેનો પ્લોટ નં. ૨૮૭,
							સોની પાર્ક હાઉસિંગ	દાસણ	: અન્ચ જમીન.
							સોસાયટી-૨, સુરત,		
ŀ	_		VMUDODU	00 40 0040			ગુજરાત– ૩૯૪૩૧૫	<u> </u>	
	3.	જੇ ઉત્તમના પુત્ર 00103735 (Applicatio		09.12.2019	Rs. 11,50,000/-	Rs. 11,51,656.45/-	૩૯, શ્રીનાથજી સોસા		મોજે ગામ તાંતીથૈયા, તાલુકો પલસાણા, જિલો સુરત
				(રૂપિયા અગિયાર	ગલી ૨, ડિંડોળી ઉદ્યના		ગુજરાત–૩૯૪૩૧૫ ના બ્લોક નં. ૨૮૮ (બ્લોક નં. ૨૮૮		
		૨. બુદ્યાભાઇ સુર્ચવંશી	n ID			(રૂપયા આગવાર	ગુંચકાવ- ૩૯૪૬ન		૨૮૯) ક્ષેત્રફળ હેક્ટર ૩–૫૩૦૧૮ ચો.મી. ખાતે આવેલ રાજ
		3. દેવકાબેન	695984)			છરસો છપાન અને	અહીં પણ: પ્લોટ નં. રાજમંદિર રેસીડેન્સી.		મંદિર રેસીડેન્સીમાં પ્લોટ નં. ૧૬૯ની મિલકતના તમામ
		સુર્ચવંશી જે દિનેશભાઇ				પીસ્તાલીસ પૈસા	રાજમાદર રસાડન્સા, નં. ૨૮૮. મોજે ગામ તાં		પીસ અને પાર્સલ. ક્ષેત્રફળ ૪૮ ચો ચાર્ડ એટલે કે ૪૦.૧૮ ચો
		ાદનશભાઇ સુર્ચવંશીના પત્ની				પુરા) ૦૯.૧૨.૨૦૧૯	ન. ૨૮૮, માજ ગામ તા તાલુકો પલસાણા, સ્	,	મી. (કેજેપી મુજબ બ્લોક નં. ૨૮૮/૧૬૯ (ક્ષેત્રફળ ૪૦.૧૮ ચો.મી)
		ર, દિનેશભાઇ				મુજબ	ગુજરાત, ૩૯૪૩૧		ચા.મા) ચતુ:સીમા: પુર્વ: સોસાચટીનો અંદરનો રોડ
- 1			1	I	I	J 3	3.200,5005		વિતુ:દાાના: યુવ: દાાદાવિદાગા અદદભા શક

ાધમાં. કારણોસર, અમે માનીએ છીએ કે તમે માંગણા નોટીસની બજવણીને અવગણી છે. પરિણામે આ માંગણા નોટીસનં પ્રકાશન છે. આથી તમને સદરહ રકમ ભાવી વ્યાજ, ખર્ચ, આકસ્મિક ખર્ચા, ચાર્જ વગેરે . હત આ માંગણા નોટીસના પ્રકાશની તારીખથી ૬૦ દિવસના ગાળામાં રેલીગેર હાઇસિંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લી. ને ચુકવવા જણાવવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતા રેલીગેર હાઇસિંગ ડેવલોપમેન્દ હ્રયનાન્સ કોર્પોરેશન લી. સિક્ચોર્ડ એસેટોમાંથી કોઇપણ એક અથવા વધુ કે તમામ સામે જણાવેલ એક્ટનીક લમ ૧૩(૪) ની તમામ કે કોઇ જોગવાઇઓ હેઠળ દેવાદાર/રોની આ સિક્ચોર્ડ એસેટોનો કબજો લેવ ાહીતની જરૂરી કાર્યવાહી કરશે. વધુમાં તમને જણાવેલ સિક્યોર્ડ એસેટની વેચાણ/ભાડે અથવા કોઇ અન્ય રીતે તબદીલી કરવાની સદરહુ એક્ટની કલમ ૧૩(૧૩) હેઠળ મનાઇ ફરમાવવામાં આવે છે. મહેરબાની

સુર્ચવંશી જે ઉત્તમ

તારીખ : ૨૩.૦૧.૨૦૨૦

બુધાભાઇ સુર્ચવંશી

કરીને નોંધ લેવી કે કોઇ અન્ય માંગણા નોટીસ જારી કરવામાં આવશે નહી. અધિકૃત અધિકારી મેસર્સ રેલીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ

kotak Kotak Mahindra Bank રજીસ્ટર્ડ ઓફિસ: ૨૭ બીકેસી, સી – ૨૭, જી બ્લોક, બાંદ્રા ક્ટલા કોમ્પલેસ, બાંદ્રા (પૂર્વ) ુ ગુજ<mark>ુઓનલ ઓફીસ :</mark> કોટક મહીન્દ્રા બેંક લી. ૪૦૧ – ૪૦૬, ચોથો માળ, સિધ્ધીવિનાર કોમ્પલેક્ષ, શીવરંજની કોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત – ૩૮૦૦૧૫.

પઝેશન નોટીસ

(સ્થાવર મિલક્ત માટે)

સિક્યુરીટી ઈન્ટરેસટ (એન્ફોર્સમેન્ટ)નિયમ ૨૦૦૨ ના પરિશિષ્ટ-૪ સાથે રુલ ૮(૧) વંચાણે લેતા કોટક મહીન્દ્રા બેંક લી. બેંકીંગ કંપની, બેંકીંગ રેગ્યુલેશન એકટ, ૧૯૪૯ જેની રજીસ્ટર્ડ ઓફીસ ૨૭ બીકેસી, સી – ૨૭, જી બ્લોક

બાંદ્રા કુરલા કોમ્પલેસ, બાંદ્રા (પૂર્વ), મુંબઇ, – ૪૦૦૦૫૧ અને **બ્રાંચ ઓફીસ** : **કોટક મહીન્દ્રા બેંક લી**. ૪૦૧–૪૦૬, ચોથો માળ, સિધ્ધીવિ કોમ્પલેંકા, શીવરંજની કોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ ગુજરાત – 3૮૦૦૧૫ ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ टीइन्स्ट्रुड्शन ओइ इायनान्सियल એसेट्स એन्ड એन्ફोर्सभेन्ट ओइ सिड्योटीटी ઇन्टरेस्ट એर्ड्ट, २००२ ना नियम उ साथे वंयाती કલમ ૧૩(૧૨) અંતર્ગત આપવામાં આવેલી સત્તાની રૂએ સિક્યોરિટાઈગ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) અંતર્ગત માંગણ નોટીસ આપી કારણ કે લોન એકાઉન્ટ ને નોન પરફોર્મીંગ એસેટસ તરીકે તા. ૦૯.૦૮.૨૦૧૫ના રોજ વર્ગીકૃત કરેલ હતા. અમે નોટીસ આપીને **ઉદ્યારકર્તાઓને (૧) વિપુલ ઠાકોરભાઇ પટેલ** રહેવાસી : ૧૦૮, દરજી સ્ટ્રીટ, ડુમ્મસ રીસોર્ટ, મગદલ્લા, સુરત, (૨) **ચારલ જીતેન્દ્રકુમાર બારોટ**, રહેવાસી : પ્લોટ નં. ૪, સાઈકૂપા, અમીકુંજ સોસાચટી, ટી.પી. નં. ૫, એફ.પી. નં. ૩૬, ઘોડદોડ રોડ, સુરત, (૩) મે. **કેલીપ્સો કેવલોપર્સ**, સરનામું : ૩૦૧, એસ એન એસ. સ્કવેર બીલ્ડીંગ, દાલ સ્કુલની પાસે, મોજે રૂંથ, વેસુ રોડ, સુરત, (૪) **નેહલ કાંતીલાલ અનીલ**, રહેવાસી : બંગલા નં. એ-પર, આશિર્વાદ રેસીડન્સી, ચાયના દરવાજા પાસે, અથલાણ, સુરત, તા. ૨૯.૦૭.૨૦૧૬. ના રોજ માંગણ નોટીસ જારી કરીને માંગણા નોટીસમાં જણાવેલ ૨૬મ ર,૨૫,૨૦,૪૬૧.૩૯ (રૂપીયા બે કરોડ પચીસ લાખ વીસ હજાર ચારસો એક્સઠ અને ઓગણ ચાલીસ પૈસા) નોટીસ મળ્યાના ૬૦ દિવસની અંદર

ઉદ્યારકર્તા સદરહુ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉદ્યારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સદરઠ કાયદા ની કલમ – ૧૩(૪) અંતર્ગત નિયમ ૮ સાથે વંચાણે લેતાં મળેલ સત્તાની રૂએ અધોહસ્તાક્ષરીએ નીચે દર્શાવેલ મિલકતોનો **પ્રત્યક્ષ કબજો** લીંધેલ છે. ઉપર જણાવેલ ઉદ્યારકર્તા ને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકતો અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહ સ્થાવર મિલકતો અંગે કરેલો કોઈપણ વ્યવહાર કોટક મહીન્દ્રા બેંક લી. ની બાકી લેણા ૨,૨૫,૨૦,૪૬૧.૩૯ (રૂપીયા બે કરોડ પચીસ લાખ વીસ હજાર ચારસો એકસઠ અને ઓગણ ચાલીસ પૈસા) અને તેના પર ઉપર પ્રમાણે તા. ૩૦.૦૭.૨૦૧૬ થી વ્યાજ સાથે કરાર પ્રમાણે વ્યાજ અને અવેજ વ્યાજ અનુસાસીક ખર્ચાઓ કોસ્ટ, ચાર્જાસ, વગેરે સાથેના બોજાને આધીન રહેશે.

"સદરહ કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાની મુકરર મિલક્ત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલક્તનું વર્ણન

- દુકાન નં. ૩૦૭, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ, વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત દુકાન નં. ૩૦૮, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્ચુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨. ટી.પી. નં. ૨૮. મોજે ઉંથ
- વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત દુકાન નં. ૩૦૯, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઇનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ
- વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકર્ત
- દુકાન નં. ૩૧૦, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકતા
- દુકોન નં. ૩૧૧, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ, વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ,
- વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકર્ત દુકોન નં. ૩૧૩, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ
- વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત દુકોન નં. ૩૧૪, શ્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ, વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકતા
- દુકોન નં. ૩૧૫, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ, વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત ૧૦. દુકાન નં. ૩૧૬, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ
- વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત ૧૧. દુકોન નં. ૩૧૭, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઈનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ,
- વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત ૧૨. દુકાન નં. ૩૧૮, ત્રીજો માળ, રઘુવીર બિઝનેસ પાર્ક-૧,જુનો રેવન્યુ સર્વે નં. ૨૭/૨, ફાઇનલ પ્લોટ નં. ૧૪/૨, ટી.પી. નં. ૨૮, મોજે રૂંથ

વેસુ રોડ, તાલુકો : મજુરા, જીલ્લો સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત તારીખ : ૨૩.૦૧.૨૦૨૦

અધિકૃત અધિકારી કોટક મહીંન્દ્રા બેંક લી.

સહી/-

Bid security Cost of Last date of Package value of work Sale of bid Period of Name of work receipt of Bid No. (Rs. in Lakhs Lakhs) (Rs.) d opening Da 2 3 9 01 / TNIAME 28.02.2020 WRD / Purchase of 10 Nos. of Nor Goods 15000 -29.01.202 at 3.00 PM Nuclear Soil Density gauge & 6 Nos. of advanced cover meter for Quality control laboratories. 3** QC / IWS 158.24 3.17 and Opening at 3.30 PM to 27.02.202 Date onwards 09.01.2020

inclusive of GST Including rainy season & water regulation period

in the Procurement Regulations

Regulations "setting forth the World Bank's policy on conflict of interest.

working day at the same time and venue. Late Bids will be rejected

Other details can be seen in the bidding document

The address for communication is as under

(a) Name & Designation of Officer

(b) Official Address

(c) Email

(d) Telephone

(e) Website

(f) Fax

Cost of tender document has to be remitted under the head of account "0701-80-800-AA-0000 0701 Maior and Medium Irrigation - 80 General - 800 Other Receipts to be credit to The Executive Engineer, PWD, WRD, Krishna Water Supply Project Division - I, Chepauk, Chennai - 5 and G.S.T has to be remitted under the G.S.T registration number of 33CHEK09589G1DZ.

Superintending Engineer, WRD, Palar Basin Circle, Chennai - 5. DIPR/546/Tender/2020

स्थण : सुरत

sepbcwrd@gmail.com

TABLE

044-2859 1231. www.tenders.tn.gov.in

. cases, the bidder is responsible for ensuring that any addenda on the website is also downloaded and incorporated.

044-2859 1231.

the bidding document and shall have to be valid for 45 days beyond the validity of the bid.